



## SARDAR PATEL UNIVERSITY

P.B.No. 10

VALLABH VIDYANAGAR – 388 120 (GUJARAT) INDIA

### પરિપત્ર

સંદર્ભ : યુનિવર્સિટી પરિપત્ર ક્રમાંક ડી/૪૭૦ તારીખ : ૧૮/૦૪/૨૦૧૭

આથી સંબંધકર્તા સર્વે વિભાગના વડાશ્રીઓ તથા સંલગ્ન કોલેજો/ઇન્સ્ટીટ્યુટ ના આચાર્યશ્રીઓને જણાવવાનું કે તારીખ ૮/૫/૨૦૧૭ ના રોજ માનનીય કુલપતિશ્રીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય પ્રવેશ સમિતિની સભાએ યુનિવર્સિટી વિભાગો તથા સંલગ્ન કોલેજો/ઇન્સ્ટીટ્યુટ માં ચાલતા અનુસ્નાતક અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮ થી વિદ્યાર્થી દ્વારા ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરીને કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિથી પ્રવેશ ફાળવવા નીચે મુજબની બાબતો મંજૂર કરેલ છે.

૧. કેન્દ્રીય પ્રવેશનું સમય પત્રક નીચે મુજબ રહેશે.

Sr. No.	PARTICULARS	Proposed Dates
(1)	Advertisement to various news papers	18/05/2017
(2)	Online Application form will be available on University Website : <a href="http://www.spuvvn.edu/students_corner/admissions">http://www.spuvvn.edu/students_corner/admissions</a>	22/05/2017 to 15/06/2017
(3)	Last Date for receipt of Hard copy of Application Form at Room Beside Corporation Bank, Sardar Patel University, Vallabh Vidyanagar.	15/06/2017
(4)	The list of eligible candidates to be admitted to the PG and Diploma Course programmes will be declared on University website : <a href="http://www.spuvvn.edu/students_corner/admissions/">http://www.spuvvn.edu/students_corner/admissions/</a> with instructions.	28/06/2017
(5)	Date of Processing Admission as per SMS received by students	3/7/2017 to 8/7/2017

૨. કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિ હેઠળ કોલેજ/ઇન્સ્ટીટ્યુટ, યુનિવર્સિટી દ્વારા મંજૂર થયેલ પ્રવેશ સંખ્યા (Intake) ની ૨૦% મેનેજમેન્ટ બેઠકો તરીકે મંજૂર કરવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ બેઠક હેઠળ પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તેમણે યુનિવર્સિટી વેબસાઇટ પર ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે તથા તેને પ્રિન્ટઆઉટ જરૂરી દસ્તાવેજો સાથે સંબંધકર્તા કોલેજ/ઇન્સ્ટીટ્યુટ માં જમા કરાવવાનું રહેશે.

કોલેજ/ઇન્સ્ટીટ્યુટ આવા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી યુનિવર્સિટીની મંજૂરી મેળવ્યાબાદ પ્રવેશ ફાળવી શકશે. જે કોલેજ/ઇન્સ્ટીટ્યુટ મેનેજમેન્ટ બેઠકો ફેઠળ પ્રવેશ ફાળવવા ન ઈચ્છતા હોય તેઓએ તારીખ ૧૬/૫/૨૦૧૭ સુધીમાં યુનિવર્સિટીને લેખિતમાં જાણ કરવાની રહશે. ત્યાર બાદ કોલેજ/ઇન્સ્ટીટ્યુટની પ્રવેશ સંખ્યામાં કોઈપણ પ્રકારનો સુધારો કરવામાં આવશે નહિ.

૩. કેન્દ્રીય પ્રવેશની માર્ગદર્શક પુસ્તિકા - ૨૦૦૧૭-૧૮ નો મુસદ્દો યુનિવર્સિટીની વેબસાઈટ [www.spuvvn.edu/studnet\\_corner/admissions](http://www.spuvvn.edu/studnet_corner/admissions) પર જરૂરી ચકાસણી અર્થે મુકવામાં આવેલ છે. આથી સર્વે વિભાગોના વડાશ્રીઓ/ કોલેજોના આચાર્યશ્રીઓને જાણ કરવામાં આવે છે કે આપના વિભાગ/કોલેજને લગતી માહિતી જેવી કે અભ્યાશક્રમો, પ્રવેશ સંખ્યા (Intake), પ્રવેશ લાયકાત, ફી, ફોન નંબર, ઈ-મેઈલ તથા વેબસાઈટ વિગેરે બાબતોમાં કોઈપણ વિસંગતતાઓ હોય તો તારીખ ૧૬/૫/૨૦૧૭ સુધીમાં યુનિવર્સિટીને લેખિતમાં જાણ કરવાની રહશે.

૪. પ્રવેશ પ્રક્રિયા સમયે વિભાગીય પ્રવેશ સમિતિ દ્વારા વિદ્યાર્થીને ફાળવેલ પ્રવેશ બાદ સંબંધકર્તા કોલેજ દ્વારા વિદ્યાર્થી પાસેથી ફી જમા લેવા માટે પોતાની કોલેજના બે પ્રતિનિધીઓને પ્રવેશ પ્રક્રિયા સ્થળે હાજર રાખવાના રહશે. કોલેજ દ્વારા વિદ્યાર્થી પાસેથી ફી જમાં લઈને તેની રીસીપ્ટ વિદ્યાર્થીને આપવાની રહશે.

૫. યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે કોલેજના કર્મચારીઓને પ્રશિક્ષણ આપવા હેતુ યુનિવર્સિટી કોમ્પ્યુટર સેન્ટર દ્વારા તારીખ : ૧૭/૦૫/૨૦૧૭ ને બુધવારના રોજ ૩:૦૦ કલાકે યુનિવર્સિટીના એમ.પી.પટેલ ઓડિટોરીયમ, ભૌતિકશાસ્ત્ર વિભાગ પાસે, રાખવામાં આવેલ છે. જેમાં કોલેજ દ્વારા કોમ્પ્યુટર જાણતા બે પ્રતિનિધીઓને મોકલવાના રહેશે.

નંબર : ડી/ઈ/૧૧૩૫

વલ્લભ વિદ્યાનગર

તારીખ : ૧૨/૦૫/૨૦૧૭

ડો. રામસિંહ રાજપૂત

કુલસચિવ

નકલ રવાના :

(૧) યુનિવર્સિટી વિભાગના વશ્રીઓ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર

(૨) આચાર્યશ્રીઓ, સંલગ્ન કોલેજ (અનુસ્નાતક અભ્યાશક્રમો), સરદાર પટેલ યુનિવર્સિટી

(૩) પી એ. તો વી. સી. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર

(૪) મુખ્ય હિશાબ અધિકારી, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર.

(૫) ડાયરેક્ટ, કોમ્પ્યુટર સેન્ટર, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર જરૂરી કાર્યવાહી અર્થે તથા સાદર પરિપત્ર ને યુનિવર્સિટી વેબસાઈટ પર મુકવા શારુ.